



પોલીસ કમિશ્નરની કચેરી, સુરત શહેર.
પોલીસ ભવન, અઠવાલાઇનસ, સુરત શહેર-૩૯૫૦૦૧
વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૧૧૧૦
કંટ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૧૩૦૪
e-mail : special.cp.sur@gmail.com



-:: ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્વયે કરેલ

સુધારા હુકમ :-

ક્રમાંક:એસ.બી./કોરોના વાયરસ/ ૮૪/૨૦૨૧

વંચાણે લીધા

(૧) ગુહવિભાગ સચિવાલય ગાંધીનગર ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ તા. ૧૨/૦૪/૨૦૨૧

(૨) ગુહવિભાગ સચિવાલય ગાંધીનગર ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ તા. ૦૬/૦૪/૨૦૨૧

(૩) અત્રેની કચેરીના ક્રમાંક:એસ.બી./કોરોના વાયરસ/ ૬૮ /૨૦૨૧ તા.૩૧/૦૩/૨૦૨૧

(૪) અત્રેની કચેરીના ક્રમાંક:એસ.બી./કોરોના વાયરસ/ ૬૯ /૨૦૨૧ તા.૩૧/૦૩/૨૦૨૧

(૫) અત્રેની કચેરીના ક્રમાંક:એસ.બી./કોરોના વાયરસ/ ૭૯ /૨૦૨૧ તા.૦૭/૦૪/૨૦૨૧

નોવેલ કોરોના વાયરસ (covid-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.

રાજ્યમાં covid-19 ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઈ રહી છે. જે અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરેલ છે. પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારે નીચે મુજબની બાબતો અમલમાં મુકવા નિર્ણય કરેલ છે. સુરત શહેર વિસ્તાર વસ્તીની દ્રષ્ટીએ ગીચ અને ભીડભાડ વાળુ હોય નોવેલ કોરોના વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે જાહેર જનતાના હિતમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને ૧૯૭૩ ની કલમ ૧૪૪ અન્વયે હું અજયકુમાર તોમર (આઇ.પી.એસ.) પોલીસ કમિશ્નર, સુરત શહેર નીચે મુજબનો હુકમ કરું છું.

-:વિસ્તાર:-

સુરત શહેર પોલીસ કમિશ્નરેટ હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

:: અમલવારીનો સમય ::

તા.૧૪/૦૪/૨૦૨૧ ના ૬.૦૦-૦૦ થી તા.૩૦/૦૪/૨૦૨૧ ના ૬.૨૪-૦૦ સુધી હુકમનો અમલ કરવાનો રહેશે.

-:હુકમ :-

- તા.૧૪/૦૪/૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ (પચાસ) થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં.
- કર્કર્યના સમય દરમિયાન સુરત શહેર વિસ્તારમાં લગ્ન/સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહીં.
- મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધી/ઉતરક્રિયામાં ૫૦ (પચાસ) થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં.
- જાહેરમાં રાજકીય/સામાજિક/ધાર્મિક કાર્યક્રમો/, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- એપ્રિલ માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં. તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.
- રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પુજા /વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પુજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રદ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.

-:શિક્ષા:-

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, અને લાગુ અન્ય કાનૂની જોગવાઈઓ સહિત, The Disaster Management Act, 2005 ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

-:જાહેર વિજ્ઞાપન:-

હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલ ચોંટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રો ઉપરથી પ્રસિધ્ધ કરાવવું.

આ હુકમ અન્વયે સુરત કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, અને લાગુ અન્ય કાનૂની જોગવાઈઓ સહિત, The Disaster Management Act, 2005 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૩/૦૪/૨૦૨૧ ના રોજ મારી સહી અને સિક્કા કરી આપેલ છે.



(અજયકુમાર તોમર)
પોલીસ કમિશ્નર,
સુરત શહેર.

પ્રતિ,

- (૧) અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧, રતથા ટ્રાફિક એન્ડ કાઇમ સુરત શહેર.
- (૨) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર
- (૩) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, તમામ સુરત શહેર
- (૪) તમામ પો.સ્ટે./ શાખા ઇન્ચાર્જશ્રીઓ, સુરત શહેર. (નકલો ચોંટાડી લાઉડ સ્પીકર, વાહન ધ્વારા જાહેરાત કરાવવા સારું)
- (૫) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુરત શહેર (તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ રવાના :-

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેન્જ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટે.) સુરત રીજીયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.
- (૧૧) જીલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિધ્ધ કરવા સારું).
- (૧૩) પો.ઈન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજીસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજીસ્ટ્રારશ્રી, ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત .
- (૧૬) રજીસ્ટ્રારશ્રી, ચીફ જ્યુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુરત.
- (૧૭) વધારાના એકઝીક્યુટીવ મેજી.શ્રી, સુરત શહેર. (નાનપુરા બહુમાળી સુરત)
- (૧૮) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. (જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત
- (૧૯) સંયુક્ત માહિતી નિયામકશ્રી, સુરત (સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દૂરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારું.)